

July 09, 2024

To,

**BSE Limited** 

Phiroze Jeejeebhoy Towers

Dalal Street

Mumbai- 400001

**Scrip Code: 532967** 

National Stock Exchange of India Limited

Exchange Plaza,

Bandra Kurla Complex,

Bandra (E), Mumbai - 400 051

Scrip ID: KIRIINDUS

Dear Sir/Madam,

#### Sub: Newspaper Publication of Notice of the Extraordinary General Meeting.

With reference to the above captioned subject and in compliance with Regulation 30 SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014, we submit herewith the copies of newspaper advertisements in respect of Notice of the Extraordinary General Meeting of the Company as published in Jai Hind - Ahmedabad edition (Gujarati) and Financial Express - Mumbai edition (English) on Tuesday, July 09, 2024.

You are requested to kindly take note of the same.

Thanking you,

Yours faithfully,

For Kiri Industries Limited

Suresh Gondalia **Company Secretary** M. No.: F7306

Encl: As stated

DYES

Plot No: 299/1/A & B. Phase-II, Nr. Water Tank, GIDC, Vatva, hmedabad – 382 445, Gujarat, India. hone: +91-79-25994477 ax: +91-79-25834960 gmall: engage@kiriindustries.com Web: www.kiriindustries.com

INTERMEDIATES

Plot No : 396/399/403/404, EPC Canal Road, Village : Dudhwada, Tal. : Padra, Dist. : Vadodara - 391450. Gujarat, India.

Phone : +91-2662-273 444

Email : intermediates@kiriindustries.com

Web : www.kiriindustries.com

CHEMICALS

Plot No : 552-A, 566, 567, 569-71, Village : Dudhwada, Tal. : Padra, Dist. : Vadodara-391450 Gujarat, India. Phone: +91-2662-273724, 25 Fax: +91-2662-273726 Email : intermediates@kiriindustries.com Web : www.kiriindustries.com

## ૪૫ લાખને બદલે ૬૫ લાખ સુધીના આવાસ 'એફોડેબલ હાઉસીંગ' હેઠળ લેવાશે

# ર ૩ જુલાઈનું ખજેટ 'સામાન્ય' નહિં પણ 'ખાસ' રહેશે

કરાશેઃ લોકસભામાં ઝટકા બાદ આગામી વિધાનસભા

ચૂંટણીઓને ધ્યાને રાખીને કદમ ઉઠાવાશે

ઓકાએ કહ્યું, 'અમે કહી દીધું છે

કે આવી જામીનની શરતો લાદી

શકાય નહીં જે જામીનનો અર્થ નષ્ટ

કરે. જો કે એવું કહેવામાં આવ્યું

હતું કે ગૂગલ પિનથી કોઈ નુકસાન

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી

એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ

કે સુપ્રીમ કોર્ટ સહિત અન્ય ઘણી

અદાલતોની બેંચે આવા નિર્ણયો

એવી શરતો મૂકી શકાય

નહીં કે જેનાથી કોઈ

આરોપીને ટ્રેક કરી શકાય

અથવા તેના વિશે માહિતી

એકત્ર કરી શકાય

આપ્યા છે જેમાં આરોપીને ગૂગલ

મેપ પિન શેર કરવા માટે કહેવામાં

આવ્યું હતું. આ પહેલા એપ્રિલમાં

સુનાવણી દરમિયાન બેંચે તેને

ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું

કે, અમને ખબર નથી કે આ

ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે

થશે પરંતુ આવી કોઈ શરત ન

લગાવવી જોઈએ. કોર્ટે કહ્યું હતું

નેવિગેશન અને લોકેશન જાણવા

માટે થાય છે. તેને જામીનની

શરતોમાં સામેલ કરીને તેનો

ગૂગલ મેપ પિનનો ઉપયોગ

કેન્દ્રમાં એનડીએ સરકારની રચના બાદ બજેટ સત્રની જાહેરાત થઈ છે.આગામી ૨૩ જુલાઈએ બજેટ રજુ થનાર છે. તે પૂર્વે વિવિધ અટકળો જોર પકડવા લાગી છે.આ વખતનું

બજેટ સામાન્ય નહિં પણ ખાસ હશે અને આમ આદમીને રાહત આપવા આમ આદમીને મહતમ રાહત આપવા પર ધ્યાન ફોક્સ પર ફ્રોકસ કરતી જોગવાઈઓ રહેવાનું માનવામાં આવે છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. મોંઘવારીને રોકવા

સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય

સંભળાવ્યો જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું

હતું કે, જામીન પર એવી શરતો

મૂકી શકાય નહીં કે જેનાથી કોઈ

આરોપીને ટ્રેક કરી શકાય અથવા

તેના વિશે અંગત માહિતી એકત્ર

શરતો સંપૂર્ણપણે ગેરબંધારણીય છે

અને ગોપનીયતાના અધિકારનું

ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટ એક

કેસની સુનાવણી કરી રહી હતી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવી

કરી શકાય.

આર્થિક રફતારને જાળવવા તથા લોકસભા ચૂંટણીમાં નબળા દેખાવ બાદ આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય લાભ થાય તેવા પગલાઓ લેવાનો પડકાર હશે.નવી સરકારની રચનામાં પ્રથમ વર્ષે સામાન્ય રીતે લોકપ્રિય પગલાઓનું દબાણ રહેતુ નથી.પરંત્ લોકસભા ચૂંટણીમાં ઝટકા બાદ હવે આવતા મહિનાઓમાં મહારાષ્ટ્ર, હરીયાણા તથા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી થવાની હોવાથી એનડીએ સરકાર માટે તે જરૂરી બની ગયુ છે અને એટલે આમ આદમીને રાહત આપતા પગલાઓ પર ધ્યાન ફોકસ કરી શકે છે.

અર્થતંત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સરકારના વચગાળાના બજેટમાં ૧૧.૧૧ લાખ

સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો

જામીનની શરતમાં ગૂગલ મેપ

પરથી લોકેશન માંગવુ ખોટું છે

ગુગલ મેપ્સ દ્વારા પોલીસ સાથે

પોતાનું લોકેશન શેર કરતો રહેશે.

સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો

આપતાં કહ્યું કે, 'જામીનની શરત

તરીકે ગૂગલ મેપ પિન શેર કરવો

એ ગોપનીયતાનું ઉલ્લંઘન છે.

આરોપીના અંગત જીવનમાં

ડોકિયું કરવું યોગ્ય નથી.' જસ્ટિસ

એ.એસ.ઓકા અને ઉજ્જવલ

ભુયાનની બેંચે કહ્યું કે, 'કોઈ પણ

કોર્ટ જામીન પર એવી શરતો લાદી

શકે નહીં જે જામીનના ઉદ્દેશ્યને

નવી દિલ્હી, તા.૮ મૂકવામાં આવી હતી કે, આરોપી

કરોડ રૂપિયાના મૂડી ખર્ચનો ટારગેટ આપવામાં આવ્યો હતો. તેમાં કોઈ કાપ મુકયા વિના ચાલુ વર્ષની ૪.૯ થી ૫ ટકાની રાજકોષિય ખાધનો ટારગેટ રાખી શકે છે. છેલ્લા વર્ષોમાં આ ખાધને અંકુશમાં રાખવામાં સફળતા મળી છે કારણ કે મહેસુલી આવકમાં વધારો થયો

> અર્થશાસ્ત્રીઓનાં કહેવા પ્રમાણે સામાન્ય રીતે નવી સરકાર પર લોકપ્રિય કદમ ઉઠાવવાનું દબાણ હોતું નથી.એનડીએ સરકાર છેલા દસ વર્ષથી જે રાહ પર ચાલી રહી છે તેમાં જ આગળ વધી શકે છે.

કારણ કે આર્થિક વિકાસની રફતાર જાળવી રાખવી પડે તેમ છે.ઉત્પાદન વધારવાનાં કદમ ઉઠાવાય શકે છે. ખર્ચ-ખરીદી-વપરાશ વધારવાની દિશામાં પગલા લેવાનું પડકારજનક બનશે.આ માટે નવી ટેકસ પદ્ધતિમાં બદલાવ શક્ય છે.જેનાંથી ખર્ચ કરવા લોકોના હાથમાં

સુત્રોના કહેવા પ્રમાણે સરકાર ૬૫ લાખ રૂપિયા સુધીનાં મકાનોને એફોર્ડેબલ હાઉસીંગમાં સામેલ કરી શકે છે. આ સિવાય આયુષ્યમાન મનરેગા, માર્ગ મકાનની યોજનામાં વધુ ફાળવણી કરી શકે છે.કૃષિક્ષેત્ર માટે ખાસ જોગવાઈ શકય છે.

### પિતા અને ડ્રાઈવરની ધરપકડ, પરંતુ પુત્ર ફરાર...

## કોણ છે મુંબઈ હિટ એન્ડ રન કેસનો આરોપી મિહિર શાહ?

પૂછપરછ બાદ વર્લી પોલીસે સાથે રાજર્ષિ બિદાવર નામનો

## મુંબઈના વર્લીમાં રવિવારે

## એન્ડ રન કેસમાં એક

દઈએ કે રાજેશ શાહ મિહિર શાહના પિતા છે, જયારે મિહિર શાહ અકસ્માત બાદથી ફરાર છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ મિહિર પણ તેની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચી ગયો હતો. પોલીસે મિહિરની ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ કરી છે. પોલીસે જણાવ્યું કે મિહિર શાહ BMW કાર ચલાવી રહ્યો હતો જેણે દંપતીને ટક્કર મારી હતી. શું તમે જાણો છો મિહિર શાહ કોણ છે...૨૪ વર્ષીય કરવા, હટાવવાનો દુરુપયોગ થવો જોઈએ નહીં. મિહિર શાહ શિવસેના (એકનાથ અગાઉ પણ આ પ્રકારના વિચિત્ર શરતી જામીન આપવામાં આવ્યા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને

મુંબઈ, તા.૮ નહીં. તે તેના પિતાને મુંબઈના વર્લીમાં રવિવારે મહારાષ્ટ્રમાં બાંધકામ અને રિયલ ચલાવી રહ્યો હતો અને તેની વ્યક્તિ રાજર્ષિ બિદાવરની BMW કાર કલાનગર, બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં ત્યજી દેવાયેલી મળી આવી હતી.

અંબાણીની હોટલના રૂમમાં છે. દ્યી જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી, જૂનાગઢ હેડ ઓફિસ : ચંદ્રકાન્ત માલવિયા સ્મૃતિ ભવન, ચોકસી બજાર, જૂનાગઢ-360001 ફોન નં. 0285-2620496, Web : www.jcombank.com લોકર દારકો જોગ જાહેર નોટીસ

આથી નીચે જણાવેલ અમારી બેન્કની ચોક્સી બજાર બ્રાન્ચ જોશીપરા અને અમદાવાદ બ્રાન્ચ ના લોકર ધારકોને આ નોટીસથી જાણ કરવામાં આવે છે કે તમો દ્વારા ભાડે રાખવામાં આવેલ લોકર નોન-ઓપરેટીવ હોય તથા લોકરનું ભાડું ચડત હોવાથી આ બાબતની રજીસ્ટ્રર એ.ડી. દ્વારા તમોને નોટીસ તારીખ 14-06-2024 ના રોજ આપવામાં આવેલ છે. તે ઉપરાંત આ જાહેર નોટીસથી જાણ કરવામાં આવે છે કે આ તા. 07-10-2024 સુધીમાં બેન્કનું બાકી રહેતું લોકર ભાડું ભરપાઈ કરી આપવું અન્યથા તા. 08-10-2024 ના રોજ નિયમ મુજબ પંચોની હાજરીમાં લોકર બ્રેક ઓપન કરવામાં આવશે. આ લોકર બ્રેક ઓપન કરવાનો ખર્ચ આપની પાસેથી વસુલ કરવામાં આવશે. આ લોકરમાંથી નીકળેલ ચીજ-વસ્તુ, સામગ્રી તા. 22-10-2024 સુધીમાં બેન્કમાંથી મેળવી લેવાની રહેશે. લોકર બ્રેક ઓપનની કાર્યવાહી બાદ બેન્કની કોઈ પણ જવાબદારી રહેશે નહીં જેની નોંધ લેશો.

લોકર નં.	લોકર ધારકનું નામ	ગામ
291	નારણભાઈ પુનભાઈ ડાભી	જૂનાગઢ
33	પંકજકુમાર ગિરધરલાલ મેહતા	અમદાવાદ
380	સતિષ વૃજલાલ વોરા	અમદાવાદ
306	ભરત ગોવિંદભાઈ લાડવા	જૂનાગઢ
277	મુસ્તાક દોસમામદભાઈ ખેબર	જૂનાગઢ
536	નાથીબેન અરજણભાઈ ઓડેદરા	જૂનાગઢ
435	લાભુબેન દામજીભાઈ સોલંકી	જૂનાગઢ
915	મોહનલાલ સગારામ મિસ્રી	અમદાવાદ
948	કોમલ મુકેશભાઈ વડેચા	અમદાવાદ
218	રાજેશભાઈ ચકુભાઈ વેકરીયા	જૂનાગઢ
	291 33 380 306 277 536 435 915	291 નારણભાઈ પુનભાઈ ડાભી 33 પંકજકુમાર ગિરધરલાલ મેહતા 380 સતિષ વૃજલાલ વોરા 306 ભરત ગોવિંદભાઈ લાડવા 277 મુસ્તાક દોસમામદભાઈ ખેબર 536 નાથીબેન અરજણભાઈ ઓડેદરા 435 લાભુબેન દામજીભાઈ સોલંકી 915 મોહનલાલ સગારામ મિસ્રી 948 કોમલ મુકેશભાઈ વડેચા

સવારે લગભગ ૫ વાગ્યે હિટ એસ્ટેટના વ્યવસાયમાં મદદ એન્ડ રન કેસમાં એક મહિલાનું કરતો હતો. ઘટના દરમિયાન મોત થયું હતું. જ્યારે તેનો પતિ મિહિર શાહ લક્ઝરી કાર ગંભીર રીતે ઘાયલ છે. લાંબી રાજેશ શાહ અને અકસ્માત વ્યક્તિ પણ હતો, જેની પોલીસે સમયે કારની અંદર રહેલા ધરપકડ કરી છે.અકસ્માત બાદ

## સવારે લગભગ પ વાગ્યે હિટ

મહિલાનું મોત થયું હતું ધરપકડ કરી છે. તમને જણાવી

ત્યાર બાદ વધુ અભ્યાસ કર્યો

# અનંત-રાધિકાના સંગીત સમારોહ બાદ

અંબાણી પરિવારે જસ્ટિન બીબર સાથે કરી મુલાકાત

રાધિકા અને અનંતની સંગીત

સેરેમની શુક્રવાર, પ જુલાઈએ

ર્ત્તે કન્વેન્શન સેન્ટરમાં થઈ

હતી. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી,

જસ્ટિન બીબરે

રાધિકા મર્ચન્ટ અને

અનંત અંબાણીના

સંગીતની સુંદર

તસવીરો શેર કરી છે

સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતની

અનેક મોટી હસ્તીઓએ ભાગ

લીધો હતો.સલમાન ખાન,

માધુરી દીક્ષિત, કિયારા

અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા,

જાહ્નવી કપૂર, રણબીર કપૂર,

આલિયા ભટ્ટ અને સારા અલી

ખાન સહિત ઘણા સ્ટાર્સ જોવા

મુંબઈ, તા.૮ જસ્ટિન બીબરે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના સંગીતની સંદર તસવીરો શેર કરી છે. તસ્વીરોમાં, જસ્ટિન અનંત અને પરિવાર સાથે હોટલમાં મુલાકાત કરતો જોવા મળે છે, જસ્ટીને અનંત અંબાણી અને રાધિકાના સંગીતમાં પરફોર્મ કરવા માટે ૮૪ કરોડ રૂપિયા લીધા હતા. પોપ સ્ટાર જસ્ટિન બીબરે તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં પરફોર્મ કરીને ધૂમ મચાવી હતી. પ્રદર્શન પછી તરત જ, જસ્ટિન બીબરે મિયામીની ફ્લાઇટ લીધી. હવે તેણે રાધિકા અને અનંતના સંગીતમાંથી ન જોયેલી તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જસ્ટિન બીબર ટૂંક સમયમાં લગ્ન કરવા જનાર કપલ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી સાથે પોઝ આપતા જોવા મળે છે. તસવીરોમાં શ્લોકા મહેતા અને આનંદ પીરામલ પણ છે. કેટલીક તસવીરોમાં અનંત અંબાણી બેસીને વાત કરતા જોવા મળે છે જયારે જસ્ટિન તેમની સામે જોઈ રહ્યો છે. બંને અનંત

મળ્યા હતા. સલમાન અને રણવીર સિંહે બેક ટુ બેક ગીતો પર પણ પરફોર્મ કર્યું હતું. સલમાને રાધિકા અને અનંતના સંગીતમાં વિકી કૌશલ સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો. જસ્ટિન બીબરે તેના ઘણા હિટ ગીતો પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 'બેબી', 'લવ યોરસેલ્ફ', 'સોરી' અને 'બેબી પીચીસ' જેવા ગીતો પર પરફોર્મ કર્યું હતું. સંગીત સેરેમની દરમિયાન જસ્ટિન બીબરે રાજા અનંત અંબાણીને પોતાની તરફ ખેંચ્યા અને પછી

ગળે લગાવ્યા. આનો એક

વીડિયો પણ સામે આવ્યો છે,

જે સોશિયલ મીડિયા પર

વાયરલ થઈ રહ્યો છે.



(CIN-L24231GJ1998PLC034094) રજીસ્ટર્ડ ઓફીસઃ ૭મો માળ, હસુભાઈ ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬ સંપર્ક નં .: (પી) +૯૧ ૭૯ - ૨૬૫૭૪૪૩૭૧/૭૨/૭૩, ફેક્સ: +૯૧ ૭૯ - ૨૬૫૭૪૩૭૪ ઈમેઈલ આઈડી: info@kiriindustries.com; વેબસાઇટ: www.kiriindustries.com

#### અસાધારણ સામાન્ય સભાની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કીરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સભ્યોની ખસાધારણ સામાન્ય સભા (ઇજીએમ) બુધવાર, જુલાઈ ૩૧, ૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ વાગે, કંપનીધારા, ૨૦૧૩ની જોગવાઈના પાલન અર્થે અને ભારત સરકારના કંપની બાબતોના મંત્રાલય (એમસીએ)ના સામાન્ય પરિપત્ર ક્રમાંક ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦, ૨૦/૨૦૨૦, ૦૨/૨૦૨૧, ૨૧/૨૦૨૧, ૦૨/૨૦૨૨, ૧૦/૨૦૨૨ અને ૦૯/૨૦૨૩ તથા સેબી પરિપત્ર ક્રમાંક SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79. SEBI/HO CFD/CMD2/CIR/P/2021/11, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/ 62. SEBI/HO/CFD/POD-2/P/CIR/2023/4 અને SEBI/HO/CFD/ CFD-POD-2/P/CIR/2023/167 (હવે પછી સંયુક્ત રીતે પરિપત્રો તરીકે ઉલ્લેખ થશે) સાથે વંચાણે લેવામાં આવતા ધ સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડીસ્ક્લોઝર રીકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન, ૨૦૧૫ (લિસ્ટિંગ રેગ્યુલેશન)નું અનુપાલન કરતાં વીડિયો કોન્ફરન્સ (V/C)ની સુવિધા મારફત ઈજીએમની નોટીસમાં જણાવેલા કામકાજ કરવા માટે યોજવામાં આવશે.

ઉપરોક્ત પરીપત્રો અને લીસ્ટીંગ રેગ્યુલેશન્સ મુજબ, ઇજીએમની નોટીસ ઈલેક્ટ્રોનિક મોડ મારફત જે શેરધારકોના ઈમેઈલ એડ્રેસ જૂન ૨૮, ૨૦૨૪, શુક્રવારના રોજ કંપની/ ડીપોઝીટરી પાસે નોંધાયેલ હશે તેઓને જ જુલાઈ ૮, ૨૦૨૪ના રોજ મોકલી આપવામાં આવેલ છે. ઇજીએમની નોટીસ કંપનીની વેબસાઇટ www.kiriindustries.com. સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com અને <u>www.nseindia.com,</u> તથા સેંટ્રલ ડીપોઝીટરી સર્વિસીસ ઈન્ડિયા લીમીટેડ (સીડીએસએલ)ની વેબસાઇટ <u>www.evotingindia.com</u> પર પણ ઉપલબ્ધ છે.

રીમોટ ઇ-વોટિંગ અથવા સભા દરમિયાન ઇ-વોટિંગ મારફત મત આપવા માટેની પાત્રતા નક્કી કરવા માટે કટ-ઑફ તારીખ બુધવાર, <u>જ</u>ુલાઈ ૨૪, ૨૦૨૪ છે.

કંપની ધારાની કલમ ૧૦૮ અને તે હેઠળ બનાવવામાં આવેલા નિયમો અનુસાર, ફક્ત ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મતદાન મારફત જ સર્વ કામકાજ કરવામાં આવશે. કટ-ઑફ તારીખે શેર ધારણ કરનાર સભ્યો માટે રીમોટ ઇ-વોટિંગ નો પ્રારંભ રવિવાર, જુલાઈ ૨૮, ૨૦૨૪ના રોજ સવારે ૯-૦૦ ક. (ભારતીય સમય)એ થશે અને મંગળવાર, જુલાઈ ૩૦, ૨૦૨૪ના રોજ સાંજના ૫-૦૦ ક. (ભારતીય સમય)એ સમાપ્ત થશે. ઉપરોક્ત તારીખ અને સમય પછી રીમોટ ઇ-વોટિંગ કરવા દેવામાં આવશે નહીં. ઇજીએમ દરમિયાન ઇ-વોટિંગ માટેની સૂચનાઓ નોટીસમાં આપવામાં આવેલી છે. રીમોટ ઇ-વોટિંગ મારફત મતાધિકારનો ઉપયોગ કરનાર સભ્યો ઇજીએમમાં ઉપસ્થિત રહી શકશે તથા ભાગ લઈ શકશે પરંતુ ઇજીએમ દરમિયાન ફરી મત આપી શકશે નહીં. નોટીસ મોકલવામાં આવ્યા પછી જેમને શેર પ્રાપ્ત કરેલ છે અને કટ-ઑફ તારીખે શેર ધારણ કરેલ છે તેવી વ્યક્તિઓ helpdesk.evoting@cdslindia.com ને વિનંતી મોકલીને લોગ ઇન વિગતો પ્રાપ્ત કરીને તેઓનો મત આપી શકશે. ઇ-વોટિંગ માટે અને લોગ ઇનની પદ્ધતિ માટે તથા વર્ચ્યુયલ સભામાં જોડાવા માટેની સૂચનાઓ ઇજીએમની નોટીસમાં આપવામાં આવેલી છે.

ઇ-વોટિંગ પ્રક્રિયાનું ન્યાયી અને પારદર્શક રીતે નિરીક્ષણ કરવા માટે ખારટીબીઆર એન્ડ એસોસીએટસ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ઇ-વોટિંગ સંબંધિત કોઈપણ પૂછપરછ માટે, શેરધારકો www.evotingindia.com પર હેલ્પ વિભાગમાં પ્રાપ્ય એફએક્ચ્રૂ અને ઈવોટીંગ મેન્યુયલ જોઇ શકે છે અથવા શ્રી રાકેશ દળવી, સીનિયર મેનેજર, સીડીએસએલ, એ વિંગ, ૨૫મો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મીલ કમ્પાઉન્ડ, એન એમ જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૧૩, ઇ-મેઈલ: helpdesk.evoting@cdslindia.com પર સંપર્ક કરી શકે છે અથવા ટોલ 🛮 ફ્રી નં. ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ પર કોલ કરી શકે છે.

તારીખઃ જુલાઈ ૦૮, ૨૦૨૪ સ્થળઃ અમદાવાદ

કીરી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ વતી સુરેશ ગોંડલીયા કંપની સેક્રેટરી

## જેમાં જામીન પર એવી શરત નુકસાન પહોંચાડે.' જસ્ટિસ સુપ્રિમ કોર્ટની સુનાવણીમાં અરજદાર બનિયાન પહેરી આવતા મહિલા જજ નારાજ થયા

છે. ઘણીવખત આ શખ્સને તુરંત દત્તાએ તેને પૂછ્યું જજ અમુક કિસ્સામાં ગુસ્સે પણ થાય છે અને નારાજગી વ્યક્ત કરતાં નિસાસો પણ

નવીદિલ્હી,તા.૮ જસ્ટિસ બી.વી. નાગરત્ના ભડકી હાઈકોર્ટથી માંડી સપ્રીમ કોર્ટમાં ઉઠ્યા હતા. તેમણે તરંત પછયું હતું ઘણીવખત એવા કિસ્સાઓ બન્યા કે, અંતે આ કોણ છે, જે બનિયાનમાં છે, જે જોઈને જજ પર ચોંકી જાય દેખાઈ રહ્યો છે, બાદમાં જસ્ટિસ

> ખહાર કાઢવા પાર્ટીમાં આવ્યો છે કે પછી આમ જ કોર્ટ માસ્ટરને પહેર્યું છે. અને આદેશ કર્યો તુરંત તેને બહાર

સોમવારે જ સુપ્રીમ કોર્ટમાં ફરી આ આદેશ આપ્યો હતો. તેમણે કોર્ટ હકીકતે એક નાઈજીરિયન શિંદે જૂથ)ના નેતા રાજેશ પ્રકારનો કિસ્સો બનતાં જજ રોષે માસ્ટરને કહ્યું કે, પ્લીઝ તેને હટાવો. નાગરિકને દિલ્હી હાઈકોર્ટમાંથી શાહનો પુત્ર છે. મિહિરે ૧૦મા સ્પ્રીમ કોર્ટમાં એક શખ્સ કિસ્સા બન્યા છે સ્પ્રીમ કોર્ટમાં આ હતા. બનિયાન પહેરીને કોર્ટની સુનાવણીમાં પહેલો મામલો નથી જયારે જસ્ટિસે સામેલ થયો હતો. કોર્ટ સાથે જોડાયેલા કોઈના કપડાં પર નારાજગી દર્શાવી

મામલા પર રિપોર્ટ આપતી વેબસાઈટ હોય. અગાઉ પણ વર્ષ ૨૦૨૦માં બાર એન્ડ બેન્ચ અનુસાર, સોમવારે એક વકીલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ ૧૧માં એક શખ્સ વીડિયો શર્ટ વગર કોર્ટમાં સુનાવણીમાં ભાગ કોન્ફરન્સિંગની મદદથી સામેલ થયો લીધો હતો. આ જોઈને જજ ગુસ્સે હતો. તેણે વીડિયો કોન્ફરન્સમાં થઈ ગયા. બનિયાન પહેરી રાખી હતી. જેથી

#### अढ़ेर नोटीस

ડીસ્ટ્રીક્ટ અમદાવાદના મોજે રાજપુર-હિરપુરની સીમના ટી.પી. સ્ક્રીમ નં. ૨૪, ફાઇનલ્ પ્લોટ નં. ૨૯ની જમીન ઉપર **જચગોપાલ કો. ઓપ. હા. સોસાચટી લિ**. માં પ્રથમ માળે આવેલ ફલેટ નં. ૧૩ વાળી મિલકતના માલિક હાલમાં દરજી પરૂલબેન ગૌરાંગભાઇ તથા દરજી ગૌરાંગભાઇ મહેન્દ્રભાઇની માલિકીની આવેલ છે.

વધુમાં જણાવવાનું કે, સદર મિલકતના અગાઉના માલિક ભોગીલાલ નરસીદાસ સોની તા ૨૨-૧૨-૧૯૮૫ના રોજ અવસાન પામેલ જેમના વારસદાર તરીકે મંગુબેન ભોગીલાલ સોની હતા તેઓએ સદર મિલકત પ્રદિપભાઇ અમૃતલાલ વ્યાસને વેચાણ આપેલ આમ ઉત્તરોઉત્તર વેચાણ થતા હાલમાં સદર મિલકત દરજી પરૂલબેન ગૌરાંગભાઇ તથા દરજી ગૌરાંગભાઇ મહેન્દ્રભાઇની માલિકી કબજામાં આવેલ અને તેઓ સદર મિલકત ભવિની એમ. પટેલ તથા મકેશ કે. પટેલને વેચાણ આપવા માંગે છે અને ભવિની એમ. પટેલ તથા મુકેશ કે. પટેલ સદર મિલકત આઇ.ડી.એફ.સી. ફસ્ટ બેંક લિ.માં ગિરો મુકીને લોન લેવા માંગતા હોવાથી અમારી પાસે ના વાંધા પ્રમાણપત્રની માંગણી કરેલ છે.

આથી મજકુર મિલકત ઉપર કે તેના ભાગ ઉપર અન્ય કોઇપણ વ્યક્તિ, અન્ય કોઇ બેંક નાણાંકિય સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હકક, હિસ્સો, હિત, સંબંધ, ગિરો, બોજો અલાખો, ઇઝમેન્ટ -રાઇટ્સ, ટેનન્સી રાઇટ, બાનાખતના હક્કો, ગણોત હક્કો, ભાડાપટ્ટાના હક્કો, ડેવલપમેન્ટના હક્કો, લીસ, પેન્ડન્સી, લિયન એટેચમેન્ટ ધરાવતા હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૧૦ (દસ)માં તમામ પ્રકારના પુરાવા સહિતની લેખીત જાણ રજીસ્ટર્ડ એ.ડી.થી નીચેના સરનામે કરવી અને જો તેમ કરવામાં કસુર કે વિલંબ થશે તો ઉપરોક્ત મિલકત ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો હકક, હિસ્સો, આવેલ નથી અને જો હોય તો તે જતો (વેવ) કર્યો છે. તેમ સમજી મુદ્દત વિત્યે ના-વાંધા પ્રમાણપત્ર આપવામાં આવશે, અને તેને આનુસંગીક કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી. અમદાવાદ.

ડી. એન. મકવાણા (એડવોકેટ) - સી-૧૨૦૪, ઇલાઇટ ગ્રીન, વંદેમાતરમ્ આર્કેડની સામે, વંદેમાતરમ્ રોડ, ગોતા, અમદાવાદ. M.: 7779072742

#### क्राहेर नोटीस

ડીસ્ટ્રીક્ટ અમદાવાદના મોજે રખિયાલની સીમના સીટી સર્વે નં. ૦૦૨૦૦૦૬, શીટ નં. ૦૦૨ સર્વે નં. ૧૧૦ થી ૧૧૫ પૈકીની જમીન ઉપર **શ્રીઘર ટેનામેન્ટ (એસ.આર.એસ.)** માં આવેલ ટેનામેન્ટ નં. ૧૪ જે આશરે ૧૭૬.૭૨ ચો.મી.ના પ્લોટ એરિયા તથા આશરે ૧૦૧.૪૩ ચો.મીના બાંધકામ સહિતની મિલકતના અગાઉના માલિક વીરજીભાઇ પુનમભાઇ પટેલ તા. ૧૮ ૫-૨૦૨૦ના રોજ અવસાન પામેલ તેઓના વારસદારોએ અન્ય વારસદાર પ્રશાંત વીરજીભાઇ પટેલની તરફેણમાં તા. ૫-૨-૨૦૨૪ દસ્તાવેજ નં. ૧૬૦૧ના રોજ હકક કમીના લેખથી હકક કમી કરેલ આમ સદર મિલકત પ્રશાંત વીરજીભાઇ પટેલની એકમાત્ર માલિકી કબજામાં આવેલ અને તેઓએ સદર મિલકત ચિરાગ મહેશભાઇ કારેલિયા તથા પિન્કલ ચિરાગ કારેલિયાને વેચાણ આપવા માંગે છે. અને ચિરાગ મહેશભાઇ કારેલિયા તથા પિન્કલ ચિરાગ કારેલિયા સદર મિલકત આઇ.ડી.એફ.સી. ફસ્ટ બેંક લિ.માં ગીરો મુકીને લોન લેવા માંગતા હોવાથી અમારી પાસે ના વાંધા પ્રમાણપત્રની માંગણી કરેલ.આથી મજકુર મિલકત ઉપર કે તેના ભાગ ઉપર અન્ય કોઇપણ વ્યક્તિ, અન્ય કોઇ બેંક, નાણાંકિય સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, સંબંધ, ગિરો, બોજો અલાખો, ઇઝમેન્ટ -રાઇટસ, ટેનન્સી રાઇટ, બાનાખતના હક્કો, ગણોત હક્કો, ભાડાપટ્ટાના હક્કો, ડેવલપમેન્ટના હક્કો લીસ, પેન્ડન્સી, લિયન એટેચમેન્ટ ધરાવતા હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૧૦ (દસ)મ તમામ પ્રકારના પુરાવા સહિતની લેખીત જાણ રજીસ્ટર્ડ એ.ડી.થી નીચેના સરનામે કરવી અને જો તેમ કરવામાં કસુર કે વિલંબ થશે તો ઉપરોક્ત મિલકત ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો હકક, હિસ્સો આવેલ નથી અને જો હોય તો તે જતો (વેવ) કર્યો છે. તેમ સમજી મુદ્દત વિત્યે ના-વાંધા પ્રમાણપત્ર આપવામાં આવશે, અને તેને આનુસંગીક કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી. અમદાવાદ. ડી. એન. મકવાણા (એકવોક્ટ) - સી-૧૨૦૪, ઇલાઇટ ગ્રીન, વંદેમાતરમ્ આર્કેડની સામે, વંદેમાતરમ્ રોડ, ગોતા, અમદાવાદ. M.: 7779072742

### આધાર હાઉસીંગ ફાઇનાન્સ લિમીટેડ

Aadhar કોર્પોરેટ ઓફીસ : યુનિટ નં.૮૦૨, નટરાજ રૂસ્તમજી, વેસ્ટર્ન એક્ષપ્રેસ હાઇવે અને એમ.વી.રોડ, અંધેરી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૯. મહેસાણા બ્રાન્ચ : ઓફીસ નં.૩૦૫, ૩જો માળ, રાજકમલ સીટી મોલ, રાજકમલ પેટ્રોલ પમ્પ પાસે, સ્ટેટ હાઇવે, મહેસાણા-૩૮૪ ૦૦૨ (ગુજરાત)

#### ઇ-હરાજી ઃસેલ નોટીસ

સિક્યોરીટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટસેટસ્ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના નિયમો ૮(૬)ની જોગવાઇઓ સાથે વંચાણે લેતા સ્થાવર મિલકતોની ઇ-હરાજીથી વેચાણ અંગેની નોટિસ આથી જાહેર જનતાને સામાન્યપણે અને ઋણકર્તા(ઓ) અને જામીનદાર(ઓ)ને વિશેષરૂપે નોટિસ આપવામાં આવેછે કે નીચે દશવિલ સ્થાવર મિલકતો જે આધાર હાઇસીગ ફાઇનાન્સ લિમીટેડને ગીરો મુકાયેલ છે, તેનો વાસ્તવિક કબજો આધાર હાઉસીગ ફાઇનાન્સ લિમીટેડનાં અધિકૃત અધિકારીએ લઇ લીધો છે. તે ''જ્યા છે, જેમ છે, જે કંઇ છે તેના આધારે '' અને જેના પરનો બોજો જાણમાં છે તેની વિગતો નીચે દર્શાવેલ છે તે વેચવામાં

-11-	નશ.					
ક્રમ નં.	ઋણકર્તા(ઓ) / સહ-ઋણકર્તા(ઓ) / જામીનદાર(ઓ)	ડીમાન્ડ નોટીસની તારીખ અને રકમ	સ્થાવર મિલકતોનું વર્ણન	અનામતની ૨કમ	ઇએમડી (અનામતની રકમના ૧૦%)	કબજાનો પ્રકાર
1	(લોન કોડ નં. ૦૩૫૧૦૦૦૦૪૧૧ / અમદાવાદ બ્રાન્ચ) શૈલેપકુમાર મફતલાલ પટેલ (ઋણકર્તા) પંચશીલ પટેલ (સહ-ઋણકર્તા)	15-05-2023 & ₹ 9,07,898/-	સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો જે ગ્રાઉન્ડ ફ્લોરની મિલકત નં.૩૧૯૯, ભવાનપુરા સ્ટેશન, મહેસાણા, ગુજરાત-૩૮૨૮૩૦ સ્થિત છે તેની ચતુર્દિશા નીચે મુજબ છે. પુર્વ : પટેલ ગીતાબેન પંકજભાઇનું મકાન, પશ્ચિમ : નવેરી, ઉત્તર : ફાર્મ, દક્ષિણ : રોડ.	Rs. 9,56,448/-	Rs. 95,645/-	વાસ્તવિક
2	(લોન કોડ નં. ૨૯૬૧૦૦૦૦૧૫૪ / મહેસાણા બ્રાન્ચ) ધવલભાઇ રતિભાઇ સોલંકી (ઋણકર્તા) આનંદ રતિલાલ સોલંકી અને ભાવનાબેન ભરતભાઇ રાઠોડ (સહ-ઋણકર્તા)	11-07-2023 & ₹ 21,07,081/-	સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો જે માત્ર ગ્રાઉન્ડ ફ્લોરની મિલકત પ્લોટ નં. ૨૭, ક્રિપ્શા હેરીટેજ, આદર્શ રોડ, રાધનપુર, ગુજરાત-૩૮૫૩૪૦ સ્થિત છે તેની ચતુર્દિશા નીચે મુજબ છે. પુર્વ : પ્લોટ નં.૨૮, પશ્વિમ : રેવન્યુ સર્વે નં. ૧૭/પૈકીની જમીન, ઉત્તર : પેસેજ/ રોડ, દક્ષિણ : રોડ.	Rs. 14,93,568/-	Rs. 1,49,357/-	વાસ્તવિક
3	(લોન કોડ નં. ૨૯૬૧૦૦૦૧૯૭ / મહેસાણા બ્રાન્ચ) સવિતાબેન કાંતિલાલ બોડાણા (ઋણકર્તા) કુણાલભાઇ કાંતિલાલ બોડાણા (સહ-ઋણકર્તા)	09-01-2024 & ₹ 10,49,624/-	સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો જે ગ્રાઉન્ડ ક્લોરની મિલકત જે આશાપુરા-૧ ની દક્ષિણ દિશા તરફ આવેલ પ્લોટ નં.૭૬ પી છે જે પાલનપુર હાઇવે, ડીસા, જી.બનાસકાંઠા, ગુજરાત-૩૮૫૫૩૫ સ્થિત છે તેની ચતુર્દિશા નીચે મુજબ છે. પુર્વ : ૨૦ ફુટ પહોળી રસ્તો, પશ્ચિમ: પ્લોટ નં.૭૭ પી ની હદ (બ્લોક નં.૬૧), ઉત્તર : પ્લોટ નં.૭૬ પી ની હદ (બ્લોક નં.૪૧) દક્ષિણ : પ્લોટ નં.૭૭ પી ની ઉત્તર તરફની હદ (બ્લોક નં.૪૩).	Rs. 5,22,864/-	Rs. 52,286/-	વાસ્તવિક

- અમાારી ઉપરનાં સરનામે શાખા ખાતે 🛭 કે.વાય.સી સાથે ઇ.એમ.ડી.ની રકમનો ડીમાન્ડ ડ્રાફ્ટ, ટેન્ડર ફોર્મ અને ટેન્ડર ફોર્મની શરતો અને નિયમો સ્વીકૃતી (ટેન્ડર ડપક્યુમેન્ટ) જમા કરાવવાની અથવા https://bankeauctions.com પર અપલોડ કરવાની છેલ્લી તારીખ ૨૩-૦૭-૨૦૨૪ ના રોજ સમય સાંજે ૫.૦૦ વાગ્યા સુધીનો છે. છેલ્લી તારીખની નિયત સમય મર્યાદા બાદ મળેલ ટેન્ડર ડોક્યુમેન્ટ્સ અમાન્ય ગણાાશે અને તે અસ્વીકૃત ગણાશે. તેની ઇએમડી પર વ્યાજ ચુકવાશે નહી.
- https://bankeauctions.com પર બીડ / ઓફર ખુલવાની (હરાજીની તારીખ) ૨૪-૦૭-૨૦૨૪ સમય બપોરના ૩.૦૦ થી ૪.૦૦ નો રહેશે. આધાર હાઇસીગ ફાઇનાન્સ લિમીટેડ ઉપરોક્ત મિલકત પર કોઇ જવાબદારી હોય તે માટે જવાબદાર નથી. મિલકતની હરાજી "જયા છે, જેમ છે, જે કંઇ છે" તેના આધારે વેચવામાં
- ડીમાન્ડ ડ્રાફ્ટ આધાર હાઉસીંગ ફાઇનાન્સ લિમીટેડ ના નામનો જ હોવો જોઇએ. હરાજી / બીડીંગ માત્ર વેબસાઇટ https://bankeauctions.com પર "ઓનલાઇન ઇલેક્ટ્રોનિક બીડીંગ" દ્વારા જ કરાશે.
- ઇરાદો ધરાવતા બીડરોએ તેઓના નામ લિન્ક https://bankeauctions.com/registration/signup,પોર્ટલ M/s C 1 INDIA PVT LTD મારફત તેમના નામ રજીસ્ટર કરાવવા અને વિના મુલ્યે યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવા. સંભવીત બીડરો ઇ-હરાજીની ઓનલાઇન ટ્રેનીગ સેવા આપનાાર M/s C 1 INDIA PVT LTD વેબસાઇટ https://bankeauctions.com પર મેળવી શકે છે.
- વિશેષ માહિતી માટે આધાર હાઇસીગ ફાઇનાન્સ લિમીટેડનાં અધિકૂત અધિકારી, ઇસલાઉદ્દીન, કોન્ટેક્ટ નં.૯૦૦૧૨૯૨૨૦૬, સર્વીસ પ્રોવાઇડર M/s C 1 INDIA PVT LTD પ્રભાકરન મો.નં. +૯૧-૭૪૧૮૨ ૮૧૭૦૯, E-mail:tn@c1india.com & support@ bankeauctions.com, phone number +૯૧-૭૨૯૧૯૮૧૧૨૪/૨૫/૨૬ નો સંપર્ક કરવો. આજની તારીખે એએચએફએલ કે એએચએફએલ ના અધિકૃત અધિકારીને આ સ્થાવર મિલકતોને વેચાણ કરતા / નિકાલ કરતા રોકતો કોઇ કોર્ટનો હુકમ નથી.
- વેચાણની ટર્મ અને શરતોની વિગતવાર માહિતી માટે આધાર હાઉસીંગ ફાઇનાન્સ લિમીટેડ(એએચએફએલ)ની અધિકૃત વેબસાઇટ www.aadharhousing.com) જુઓ.
- બીડ વધારવાની રકમ રૂા.૧૦૦૦/- રહેશે. સ્થળ : ગુજરાત

તારીખ : ૦૯/૦૭/૨૦૨૪

સહી/-અધિકૃત અધિકારી આધાર હાઉસીંગ ફાઇનાન્સ લિમીટે

FINANCIAL EXPRESS



(CIN-L24231GJ1998PLC034094)

Regd. Office: 7th Floor, Hasubhai Chambers, Opp. Town Hall, Ellisbridge, Ahmedabad- 380006 **Contact No: (P)** +91 79-26574371/72/73, **(F)** +91 79-26574374 Email Id: info@kiriindustries.com, Website: www.kiriindustries.com

#### NOTICE OF THE EXTRA ORDINARY GENERAL MEETING

NOTICE is hereby given that the Extra Ordinary General Meeting ("EGM") of the members of KIRI INDUSTRIES LIMITED ("the Company") is scheduled to be held on Wednesday, July 31. 2024 at 11.00 a.m. (IST) through Video Conferencing ("VC") to transact the businesses as set out in the notice of the EGM, in compliance with provisions of the Companies Act, 2013 ("the Act") and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") read with General Circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 21/2021, 02/2022, 10/2022 and 09/2023 issued by Ministry of Corporate Affairs and SEBI Circular Nos.SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11, SEBI/HO/ CFD/CMD2/CIR/P/2022/62, SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 and SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 (Collectively referred to as "the Circulars").

As per the above Circulars and Listing Regulations, the Notice of EGM is sent on Monday, July 08, 2024, through electronic mode to the shareholders whose e-mail addresses are registered with the Company/Depositories as on Friday, June 28, 2024. The Notice of EGM is also available on the website of the Company at www.kiriindustries.com, website of the stock exchanges at www.bseindia.com and www.nseindia.com and website of the Central Depository Services India Limited ("CDSL") at www.evotingindia.com.

The cut-off date is Wednesday, July 24, 2024 for determining eligibility to vote through remote e-voting or e-voting during the meeting.

As per Section 108 of the Act read with rules made thereunder, the businesses will be transacted only through voting by electronic means. The remote e-voting, for the members holding shares as on cut-off date, will commence on Sunday, July 28, 2024 at 9.00 a.m. (IST) and will end on Tuesday, July 30, 2024 at 5:00 p.m. (IST). The remote e-voting shall not be allowed beyond the aforesaid date and time. The instructions for e-voting during EGM are provided in the Notice of EGM. Members exercising right to vote through remote e-voting may participate and attend the EGM but shall not be allowed to vote again during the EGM. Persons who have acquired shares and become shareholders after sending Notice and holds shares as on cut-off date, may cast their votes by obtaining the login details by sending request to helpdesk.evoting@cdslindia.com. Instructions for login for e-voting and joining virtual meeting are provided in the notice of the EGM.

M/s. RTBR & Associates, Practicing Company Secretaries has been appointed as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.

In case of queries or issues regarding e-voting, shareholders may refer to FAQs and e-voting manual available at www.evotingindia.com under help section or contact Mr. Rakesh Dalvi, Sr. Manager, CDSL, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013, E-mail: helpdesk.evoting@cdslindia.com or call on toll free no. 1800 22 55 33.

> For Kiri Industries Limited Sd/-

**Date**: July 08, 2024 Suresh Gondalia Place: Ahmedabad **Company Secretary** 

#### **RBL BANK LTD.** RBLBANK

Registered Office: 1st Lane, Shahupuri, Kolhapur - 416001. Branch Office at: RBL Bank Limited, Mahaveer", 179/E Ward, Shri Shahu Market Yard, Kolhapur-416005.

Securitisation Notice under S. 13(2) of SARFAESI Act, 2002.

We, RBL Bank Limited the secured creditor of Applicant & Co-Applicant mentioned in below mentioned columns, do hereby inform you all that your account has been classified as Non-performing Account (NPA) in pursuant to the defaults in making payment / repayment of principal and interest and the amount mentioned in the below mentioned columns is now due and payable by you as on the date of the notice, together with further interest thereon to RBL Bank Ltd. In spite of our repeated demands, you have failed and neglected to make payment / amount(s) outstanding in your account(s) and you have not discharged your liabilities.

We, therefore, issued notice under section 13(2) of Chapter III of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, demanding payment of the amounts together with further interest applicable at the contracted rates, costs, charges, other moneys to discharge your liabilities in full within 60 days from the date of the notice.

#### Loan Account Nos., Name of the Borrowers, 13(2) Notice details and Symbolic Possession Date

- 1) Mr. Hammad Mohd. Yusuf Momin (Applicant &
- 2) Mrs. Zunaira Hammad Momin (Co-Applicant &
- 3) Mr. Mohd. Yusuf Ramzan Momin (Co-Applicant & Mortgagor)
- Address of Correspondence
- 1) 904, Plot No.98/A. Lokhandwala Complex, Off Link Road.
- Andheri (West), Mumbai 400053. House No.126, Waja Mohalla, RN Compound, Bhiwandi.

Loan Account No.	Loan Amount in Rs.
809000832745	Rs. 1,20,00,000/-
809001375649	Rs. 1,55,00,000/-

**NPA Date** : 31/08/2019 13(2) Notice dated : 27/06/2024 13(2) Notice amount: Rs.1,44,02,904.31/-

- 1) M/s. Hello Mumbai (Applicant) A Proprietor Firm through its Proprietor Mr. Zhaid Ahmed Shaikh.
- 2) Mr. Zhaid Ahmed Shaikh (Co-Applicant & Mortgagor) 3) Mrs. Nahidbano Zhaid Shaikh (Co-Applicant &
- Mortgagor) Address of Correspondence
- 1) Shop No.03, Ground Floor, D Wing, Veena Beena Cooperative Housing Society Ltd., Acharya Donde Marg, Parel Sewri Division, Sewery (West) Mumbai 400 015.
- 2) Shop No. 05, Opposite Sewery Railway Station, Sewery Cross Road, Sewery (West) Mumbai 400 015.
- 3) Chawl No.14 Room no.44, Sewery Cross Road, Opposit Sewery Railway Station, Sewery, Mumbai 400 015.

Loan Account No.	Loan Amount in Rs.
809002865422	Rs. 98,63,700/-

13(2) Notice dated : 28-06-2024 13(2) Notice amount : Rs.95,20,515/- Description of Mortgaged Property

Mortgaged Property Details

Property Owned by Mr. Hammad Mahd. Yusuf Momin, Mrs. Zunaira Hammad Momin & Mr. Mohd. Yusuf

Ramzan Momin

All piece and parcel of Residential Property bearing Flat No.904/A, 9th Floor, admeasuring about 931 Sq. Fts. (Super Built-Up) i.e. 86.32 Sq. Mtrs., in building known as "Grenville Cooperative Housing Society Limited\*, constructed on Plot No.98-A, City Survey No.1/116, Survey No.41 (Part), Next to Highland Park, Oshiwara, Lokhandwala

surrounded by .. On or towards East - Lion Sol Road, On or towards South-Highland Park Building, On or towards West- B Wing/ Other Building,

Complex, Off Link Road, Andheri (West),

Mumbai 400053, which is bounded and

On or towards North-Maharana Pratap Road,

#### Description of Mortgaged Property Property Owned by Mr. Zhaid Ahmed Shaikh & Mrs. Nahidbano Zhaid Shaikh

All the piece and parcel of Commercial Property Shop No. 03, Ground Floor, D Wing, Veena Beena Co-Operative Housing Society Ltd., admeasuring about 141 Sq. Fts., CTS. No.216, Acharya Dhonde Marg, of Parel Sewri Division, Sewri (West) Mumbai 400 015, which is bounded and surrounded by ...

On or towards East - Sewree Station On or towards South - Road

On or towards West - Road On or towards North - Veena Beena Residential

Building

Now the authorized officer of RBL Bank Ltd. do hereby publish the contents of the above demand notice as provided under the Rules for discharge your liabilities in full, failing which, we shall, without any further reference, be constrained to enforce the above-mentioned security created by you in our favour by exercising any or all the rights given under the said Act. Please note that this publication is made without prejudice to such rights and remedies as are available to RBL

Bank against the borrower and the guarantors of the said financial under law. You are further requested to note that as per section13 (13) of the said Act, you are restrained/prohibited from disposing of or dealing with the above security or transferring by way of sale, lease or otherwise of above secured asset, without our prior

**Authorised Officer** Place: Mumbai Abhay Nikam, RBL Bank Ltd. Date: 06/07/2024

NOTICE

NOTICE IS HEREBY GIVEN THAT THE SHARE CERTIFICATE(S) NO(S) 25521, 41609, 221261, 221262, 221263 & 221264 FOR 15, 50, 50, 50, 50 & 50 ORDINARY SHARES, BEARING DISTINCTIVE NO(S) 1196894-1196908, 2073049- 2073098, 8172270-8172319, 8172320-2172369, 8172370-8172419 & 8172420-8172469 OF MAHARASHTRA SCOOTERS LIMITED STANDING IN THE NAME OF NARAYANDAS I HAS/HAVE BEEN REPORTED LOST/STOLEN AND THAT AN APPLICATION FOR ISSUE OF DUPLICATE CERTIFICATE(S) IN RESPECT THEREOF HAS BEEN MADE TO THE COMPANY KFIN TECHNOLOGIES PVT LTD TO WHOM OBJECTION, IF ANY, AGAINST ISSUANCE OF SUCH DUPLICATE CERTIFICATE(S) SHOULD BE MADE WITHIN 15 DAYS FROM THE DATE OF PUBLICATION OF THIS NOTICE. THE PUBLIC ARE CAUTIONED AGAINST DEALING IN ANY MANNER WITH THESE SHARES.

NARAYANDAS NAVALRAI RIZWANI



FINCORP

## **HERO FINCORP LIMITED**

CIN: U74899DL1991PLC046774 Regd Office: 34, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057

Tel: 011-49487150 | Fax: 011-49487150. Email: litigation@herofincorp.com | Website: www.herofincorp.com

POSSESSION NOTICE [(APPENDIX IV) RULE 8(1)] Whereas the Authorized officer of Hero FinCorp Limited (HFCL), a Non-Banking Financial Company, under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 0F 2002) (hereinafter referred to as "Act") and in exercise of the powers conferred under Section 13(2) of the Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rule, 2002 issued a Demand Notice dated 29.03.2024, calling upon:

- M/s Ratnamani Art Jewel (Borrower/Addresee No.1) Through its Proprietor Mr. Bharat Kumar Sardarmal Jain Having its Office at: Shop No. 2B, Patwa Chawl Ground Floor 98-5 K, Menon Street, Zaveri Bazar, Mumbai Maharashtra- 400002 Email-ratnamaniartjewel@gmail.com Mob.: 9619603795 Also at: 1, B/104 Sumer Tower, ND 04, Seth Mutisha Lane, Mazgaon, Mumbai, Maharashtra- 400010
- Mr. Bharat Kumar Sardarmal Jain (Co-Borrower/Addressee No.2) Residing at: Flat No. 27, Plot No. 19, 3rd Floor, Jawahar Nagar, Narhari Sadan, S.V. Road, Goregaon West Mumbai, Maharashtra- 400104 Mr. Muvic Bharat Jain (Co-Borrower/Addressee No.3) Residing at: B-Wing Flat
- No. 104, Sumer Tower No. 4, 1st Floor Seth Mutisha Lane Opp Telephone Exchang, Mazgaon, Mumbai, Maharashtra- 400010 to repay the amount mentioned in the notice Rs. 47,58,611.25 (Forty Seven Lakh Fifty

Eight Thousand Six Hundred Eleven Rupees and Twenty Five Paise only) due as on 13.03.2024 along with the applicable interest and other charges within Sixty (60) days from the date of receipt of the said notice. The Borrower having failed to repay the amount, Notice is hereby given to the Borrower

and the public in general that the undersigned has taken the possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with

the property and any dealings with the property will be subject to the charge of HFCL for an amount of Rs. 47,58,611.25 (Forty Seven Lakh Fifty Eight Thousand Six Hundred Eleven Rupees and Twenty Five Paise only) due as on 13.03.2024 along with the

The attention of the Borrower is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured asset.

**DESCRIPTION OF IMMOVABLE PROPERTY IS AS UNDER:** "All that piece or parcel of flat no. 04, admeasuring 248 sq. ft. Carpet Area, on the 1st floor, in Wing B, in the building known as "Sumer Tower No. 4", AT Seth Motisha Lane, Opposite MTNL Tower, Mazgoan, VTS, Mumbai 4000 010, constructed on all that price and parcel of land bearing Cadastral Survey no. 399, Lying being and situated Love Lane, Mazgaon Division, Bombay bounded as under: Towards East: Mount road, Towards West: BTT Chawls, Towards North: Sumer Tower No. 3, Towards South: Seth Motisha Lane"

PLACE: MUMBAI SD/-, AUTHORIZED OFFICER, DATE: 05.07.2024 HERO FINCORP LIMITED



1913-2022

### INDIA GELATINE & CHEMICALS LIMITED

CIN: L99999GJ1973PLC002260

Registered Office: 703/704, 'Shilp', 7th Floor, Near Municipal Market, Sheth C.G. Road, Navrangpura, Ahmedabad - 380 009. E-mail ID: investor@indiagelatine.com Website: www.indiagelatine.com • Tel: +91-79-26469514

## NOTICE

(For the attention of Equity Shareholders of the Company)

Sub.: Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF)

This notice is published pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 and Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, dated 7th September, 2016 read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Amendment Rules, 2017 dated 28th February, 2017 and Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Second Amendment Rules, 2017 dated 13th October, 2017.

The Rules, amongst other matters, contain provisions for transfer of all shares in respect of which dividend has not been encashed or claimed by the shareholders for seven consecutive years or more to be transferred by the Company in the name of Investor Education and Protection Fund (IEPF), a fund constituted by the government of India under Section 125 of the Companies Act 2013.

The Stakeholders may note that the dividend declared by the Company for the financial year 2016-17 which remained unclaimed for the period of seven years, is also due to be transferred to IEPF on respective date. The corresponding shares on which dividend was unclaimed for seven consecutive years are due for transfer and will be transferred to the IEPF as per the procedure set out in the Rules.

Adhering to the various requirements set out in the above said Rules, the Company has communicated individually to the concerned shareholders whose shares are liable to be transferred to Investor Education and Protection Fund (IEPF) under the said Rules for taking appropriate action(s) at their latest available addresses.

The Company has uploaded the details of such shareholders and shares due for transfer to Investor Education and Protection Fund (IEPF) on its website at www.indiagelatine.com. Shareholders are requested to refer the same to verify the details of uncashed dividends and the shares liable to be transferred to IEPF pursuant to the Rules.

It may please be noted that if no response or claim is received by the Company or the Registrar & Share Transfer Agent (RTA) by October 20, 2024 or such other date as may be extended, the Company shall for purpose of adhering with the requirements of the Rules, transfer the shares to the Investor Education and Protection Fund (IEPF) by the due date, without any further notice, by following the due process as enumerated in the Rules, which is as under:

- In case of the shares held in physical form: by issuance of duplicate share certificate and thereafter transferring the same to IEPF authority. The Original share certificate(s) which stand registered in the name of the shareholder will be deemed cancelled and non-negotiable:
- II. In case of the shares held in demat mode: by transfer of shares directly to demat account of IEPF Authority by way of corporate action with the help of Depositories and Depository Participants;

Shareholders may note that both the unclaimed dividend and the shares transferred to Investor Education and Protection Fund (IEPF) including all benefits accruing on such shares, if any, can be claimed back by them from IEPF Authority after following the procedure prescribed in the Rules.

In case the shareholders have any queries on the subject matter and the Rules, they may contact the Company's Registrar and Share Transfer Agent (RTA) at M/s Link Intime India Pvt. Ltd., C-101, 247 Park, L B S Marg, Vikhroli (West), Mumbai- 400083. Tel No.: (0)8108116767, E-mail: rnt.helpdesk@linkintime.co.in /iepf.shares@linkintime.co.in For, India Gelatine & Chemicals Limited

Place: Mumbai Date: 8th July, 2024

Sd/-Tanaya T. Daryanani Company Secretary Membership No.: A37181





SEAMEC LIMITED CIN: L63032MH1986PLC154910

Read. & Corporate Office: A 901-905. 9th Floor, 215 Atrium, Andheri Kurla Road, ndheri (East) Mumbai - 400 093, India. | Tel: +91-22-66941800; Fax +91-22-66941818 Email: contact@seamec.in | Website: www.seamec.in

#### INFORMATION REGARDING THE 37™ ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING/OTHER AUDIO - VISUAL MEANS

NOTICE IS HEREBY GIVEN THAT the 37th Annual General Meeting ("AGM") of the Members of SEAMEC LIMITED ("Company") will be held on Thursday, August 08, 2024 at 04:00 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") in compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") read with the Ministry of Corporate Affairs, Government of India ("MCA" General Circulars dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021 December 08, 2021, December 14, 2021, May 5, 2022, December 28, 2022 and September 25, 2023 together ("MCA Circulars") and the Circulars issued by the Securities and Exchange Board of India ('SEBI') dated January 15, 2021, May 13, 2022, January 05, 2023 and October 07, 2023 read with Master Circular dated July 11, 2023 together ("SEBI Circulars") to transact the business as set out in the Notice convening AGM.

1. Dispatch of Notice of AGM and Annual Report

In compliance with the aforesaid MCA Circulars and SEBI Circulars, the Integrated Annual Report of the Company for the Financial Year 2023-24 along with the Notice of the AGM. Financial Statements and other Statutory Reports will be sent through electronic mode only to such members whose email addresses are registered with the Company Depository Participants ("DP's") and will all be made available on the website of the Company at www.seamec.in and on the website of NSDL at www.evoting.nsdl.com. Additionally, Notice of the AGM will also be available on the website of the Stock Exchanges on which the securities of the Company are listed i.e. at www.bseindia.com and www.nseindia.com. Members can join and participate in the AGM through the VC OAVM facility ONLY. The instructions for joining the AGM will be provided in the Notice of the AGM. Members participating in the meeting through VC / OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

However, in accordance with the SEBI Circular, the Company shall send a physical copy of the Integrated Annual Report to those Members who request for the same at contact@seamec.in mentioning their Folio No. / DP ID and Client ID.

2. Manner of Registering/Updating Email Address:

The Members holding shares in dematerialized mode are requested to register / update their email addresses with their relevant Depositories through their DP. Members holding shares in physical mode are requested to furnish their email addresses with Company's Registrar and Share Transfer Agent at rta@cbmsl.com or to the Company at contact@seamec.in. 3. Manner of Casting Votes through e-Voting

The Company has availed services from NSDL for providing remote e-Voting facility ("remote e-Voting") to all the members to cast their vote on all the Resolutions which are set out in the Notice of the AGM. Members have the option to cast their vote using the remote e-Voting or e-Voting system during the AGM. The manner of remote e-Voting for the Members holding shares in dematerialized and physical mode will be provided in the Notice of the AGM.

4. Joining AGM through VC/OAVM:

Members can participate in the ensuing AGM through VC/OAVM as per the instructions mentioned in the Notice of the AGM. Members who need assistance before or during the AGM, can contact Ms. Simoni Kanani, Manager & Assistant Company Secretary, Tel: 022. 66941800, Email-contact@seamec.in or call NSDL on the toll-free number: 022 - 4886 7000 or send a request / contact Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL at

Members are requested to carefully read all the Notes set out in the Notice of the GM and in particular, instructions for joining the AGM, manner of casting vot through remote e-voting or e-voting during the AGM.

Place: Mumbai Date: July 08, 2024

S.N. Mohanty President - Corporate Affairs, Legal and Company Secretary

For SEAMEC LIMITED

**D-Link** 

D-Link (India) Limited

Regd. Office: Plot No. U02B, Verna Industrial Estate, Verna, Salcette, Goa - 403722. Email id: shares@dlink.co.in; Website: https://www.dlink.com/in/en Phone: 0832-2885800

Notice of Annual General Meeting, E-Voting Information and record date NOTICE is hereby given that the 16th Annual General Meeting (AGM) of the members

of the Company will be held on Wednesday, August 7, 2024, at 11:00 a.m. (IST) through Video Conferencing (VC) facility /Other Audio-Visual Means (OVAM), to transact the business as set out in the Notice of AGM.

The Annual Report for the financial year 2023-24 along with the Notice convening AGM,

is being dispatched through electronic mode to the Members whose email addresses are registered with the Company and/or Depositories in accordance with the Circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India Members may note that the Notice and Annual Report of the Company for the financial year 2023-24 is available on the Company's website: https://www.dlink.com/in/en and websites of the Stock Exchanges. The Members are requested to refer to the AGM notice, for instructions for attending the AGM through VC / OAVM.

In compliance with Section 108 of the Companies Act, 2013 ('the Act') read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, the Secretarial Standard on General Meetings ('SS-2') issued by the Institute of Company Secretaries of India and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing to its Members the facility of remote e-voting before as well as during the AGM in respect of the business to be transacted at the AGM and for this purpose, the Company has appointed KFintech for facilitating voting through electronic means.

The detailed instructions for remote e-voting are given in the Notice of the AGM. Members are requested to note the following:

- a) Ordinary and Special business as set out in the notice of the 16th AGM may be transacted only through voting by electronic means.
- The remote e-voting period commences on August 4, 2024, at 9:00 a.m. (IST) and ends on August 6, 2024, at 5:00 p.m. (IST). The e-voting module will be disabled by KFintech for voting thereafter.

Those members, who will be present in the AGM through the VC / OAVM facility and

- have not cast their vote on the resolutions specified in the 16th AGM notice through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system during the AGM. A person whose name is recorded in the Register of Members / Register of Beneficia
- Owners as on the Cut-off Date i.e., Wednesday, July 31, 2024, only shall be entitled to avail of the facility of remote e-voting / e-voting at the AGM. The procedure for registration of e-mail addresses and bank details by shareholders is given in the AGM
- ) The members who have cast their vote(s) by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote(s) again in the AGM.
- Any person who acquires shares of the Company and becomes a Member of the Company after sending the Notice and holding shares as of the cut-off date may obtain the login ID and password by sending a request to evoting@Kfintech.com. However if he/she is already registered with KFintech for remote e-voting then he/she can use his/her existing User ID and password for casting the vote. A person, not a member as on the Cut-off Date should treat the Notice of the AGM for information purposes

Record date for dividend and payment thereof:

- a) The Shareholders may note that the Board of Directors has recommended a dividend of ₹8/- per equity share and a special dividend of ₹5/- per equity share totaling ₹13/- per equity share for the financial year ended March 31, 2024. Pursuant to Section 91 of the Companies Act, 2013, Notice is hereby given that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Saturday, July 13, 2024, to Friday, July 19, 2024 (both days inclusive) for the purpose of AGM and entitlement of dividend, if any. The Company has fixed the record date as July 12, 2024, for the purpose of determining the eligibility of members entitled to receive dividends if declared at the AGM.
- Subject to the approval of the Members at the forthcoming AGM, the Dividend shall be payable within thirty days of declaration of the same to the Members whose names appear on the Company's Register of Members as on the Record Date and in respect of the shares held in dematerialized mode, to the Members whose names are furnished by National Securities Depository Limited and Central Depository Services (India) Limited as beneficial owners as on that date
- As per the relevant circulars, payment of dividends shall be made through electronic mode to the members who have updated their bank account details. SEBI, vide its circular dated November 03, 2021, March 16, 2023, and November 17, 2023, mandated that the security holders (holding securities in physical form), whose folio(s) are not updated with the KYC details shall be eligible for any payment including dividend, in respect of such folios, only through electronic mode with effect from April 01, 2024. Hence, they are requested to contact the RTA of the Company to update these details.

 To avoid delay in receiving the dividend. Shareholders holding shares in physical form are requested to update their details with the RTA before the record date in order to receive dividends directly to their bank accounts on the payout date. The shareholders holding shares in demat form are required to contact their respective depository participants to update their bank details.

For detailed instructions pertaining to e-voting, members may please refer to the section "Notes" in the Notice of the Annual General Meeting. In case of any queries/grievances. you may refer the Frequently Asked Questions (FAQs) for members and e-voting User Manual available at the 'download' section of https://evoting.kfintech.com or contact Ms. Shobha Anand of Kfin Technologies Ltd, (Unit: D-Link (India) Limited), Selenium Tower B, Plot No. 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Serilingampally Hyderabad - 500 032 at e-mail einward.ris@kfintech.com or phone no. 1-800-309-4001 (toll-free).

Place: Verna-Goa

For D-Link (India) Limited Shriniyas Adikesar Company Secretary

Pune

Membership No. A20908

financialexp.epapr.in